

India seeks 50% reduction in Pakistan High Commission Strength

June 23, 2020

પાકિસ્તાનનાં હાઈ કમિશનની સંખ્યામાં 50% ઘટાડો ઈચ્છે છે

જૂન 23, 2020

આજે પાકિસ્તાનનાં ચાર્જ ડી' અફેર્સને વિદેશ મંત્રાલય પર તેડું મોકલવામાં આવ્યું હતું અને માહિતી આપવામાં આવી હતી કે ભારતે વારંવાર હાઈ કમિશનનાં અધિકારીઓની પ્રવૃત્તિઓ વિશે ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેઓ જસૂસીનાં કાર્યોમાં જોડાયેલા રહ્યા છે અને આતંકવાદી સંસ્થાઓ સાથે વ્યવહાર કરવાનું જાળવી રાખ્યું છે. 31 મે 2020 નાં રોજ રંગે હાથ પકડાયેલા અને દેશનિકાલ કરવામાં આવેલા બે અધિકારીઓની પ્રવૃત્તિઓ આ સંદર્ભમાં એક ઉદાહરણ હતું.

જ્યારે તેઓનાં અધિકારીઓ હાઈ કમિશનમાં તેઓનાં વિશેષાધિકારપ્રાપ્ત હોદ્દા સાથે સુસંગત ન હોય તેવા કાર્યોમાં સામેલ થયા હતા, ત્યારે સમાંતર રીતે પાકિસ્તાન ઈસ્લામાબાદમાં સ્થિત ભારતીય હાઈ કમિશનનાં અધિકારીઓને તેઓનાં કાયદેસરનાં રાજદ્વારી કાર્યો કરવાથી રોકવા માટે ધમકી આપવા માટેનાં સતત અભિયાનમાં જોડાયેલું રહ્યું છે. તાજેતરમાં બંદૂકની આણી પર બે ભારતીય અધિકારીઓનું અપહરણ અને તેઓ સાથે અન્યંત ખરાબ વ્યવહાર કરવો તે દિશામાં પાકિસ્તાન કંઈ હદ સુધી ગયું છે તે રેખાંકિત કરે છે. 22 જૂન 2020 નાં રોજ ભારત પરત ફરેલા આ અધિકારીઓએ પાકિસ્તાનની એજન્સીઓનાં હાથે તેઓને અનુભવ થયો હતો તેવા બર્બરતાપૂર્ણ વ્યવહારની વિચલિત કરી નાંખે તેવી વિગતો પ્રદાન કરી છે.

પાકિસ્તાન અને તેનાં અધિકારીઓની વર્તાણુક રાજદ્વારી અને કોન્સ્યુલર અધિકારીઓ સાથેનાં વ્યવહાર પરનાં વિષેના કન્વેન્શન દ્વિવપક્ષીય સમજૂતિઓ સાથે સુસંગતતામાં નથી. તેનાંથી વિપરીત, તે સીમા-પાર હિંસા અને આતંકવાદને સમર્થન આપવાની બૃહદ નીતિનો સ્વાભાવિક ઘટક છે.

તેથી, ભારત સરકાર દ્વારા નવી દિલ્હીમાં પાકિસ્તાનનાં હાઈ કમિશનનાં સ્ટાફની સંખ્યામાં 50% ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પારસ્પરિક રીતે એકસમાન ગુણોત્તર માત્રામાં પાકિસ્તાનમાં તેની પોતાની હાજરીની સંખ્યામાં ઘટાડો કરશે. સાત દિવસોમાં અમલમાં મૂકવો આવશ્યક એવો આ નિર્ણય પાકિસ્તાનનાં ચાર્જ ડી' અફેર્સને પાઠવવામાં આવ્યો હતો.

નવી દિલ્હી

જૂન 23, 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.